CIN: L36911GJ2014PLC078802

Date: 31.05.2023

To
The General Manager-Listing
Corporate Relationship Department
The BSE Limited
Phiroz Jeejeebhoy Tower
Dalal Street, Mumbai-400001
Scrip Code: 540936

Sub: Submission of audited Financial Results of the Company for the Quarter and year ended 31st March, 2023, published in Newspaper

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to above, please find enclosed the copy of newspaper advertisement dated 30th May 2023, which was published in Newspapers Business Standard (in English) and Jai Hind-Ahmedabad (in Gujarati) edition with regard to the audited Financial Results of the Company for the Quarter and year ended 31st march, 2023, duly reviewed by Audit Committee and approved by Board of Directors at their meeting held on May 29, 2023

You are requested to take the same on records, upload at your website & intimate the same to the members of the Stock Exchange.

Thanking You,

FOR GAUTAM GEMS LIMITED

Gautam Pravinchandra Sheth Digitally signed by Gouzzon Phatechanda Sheth Uhr, evils, evil-broom, Isther 1931, passed on proceedings of the passed on privilege (India (India

GAUTAM PRAVINCHANDRA SHETH MANAGING DIRECTOR

DIN: 06748854







ડેટ રીકવરી ટ્રીખ્યુનલ પાસે ૧.૫૮ લાખ કેસ પેન્ડીંગ

નવી દિલ્હીઃ દેશમાં કોર્પોરેટ વસેનાતની પ્રક્રિયા પણ ઠપ્પ થઈ રાહત ઓફર કરીને ધિરાણ લાખ કરોડની ૨કમના ૧.૧૦ ક્ષેત્રને માટે બાકી ધિરાણ અને પડી હોય તેવા ડેટ રીકવરી ભરપાઈ થઈ જાય તે જોવા લાખ કેસ નોટીકલ લાવવામાં નો ન - પર્ફો મીંગ એ સેટ સમાં ટ્રીબ્યુનલ સમક્ષ રાષ્ટ્રીયકૃત જણાવાયુ છે. આ માટે રાષ્ટ્રીયકૃત આવ્યા છે. આ પ્રકારના કેસનો

(એનપીએ)માં ઉપરાંત કેટ બેન્કોના પેન્ડીંગ છે તેમાં ૭૨- બેન્કોએ તેની પોલીસી ઘડવાની નિફાલ કરતા સમયે સરકારી બેન્કોને નાણામત્રાલયનો આદેશઃ રૂા. ૨૦ લાખથી રૂા.૧ કરોડના ધિરાણમા સૌથી વધુ એન.પી.એ. કેસ-ટુ-કેસ જામીનગીરી વિ. ફેકટર પણ જોવાશે રીકવરી ટ્રીબ્યુનલ તથા નેશનલ ૭૪% કેસ રૂા.૩૦ લાખથી રૂા.૧ રહેશે અને તેમાં કેસ-ટ્ર-કેસ આ જામીનગીરીમાં જે મિલ્કત- સ્ટોક

કંપની લો -ટ્રીબ્યુનલ દ્વારા કરોડની ધિરાણ મર્યાદા અંગેના પ્રકારે વન-ટાઈમ સેટલમેન્ટ વિ. ગેરેન્ટીમાં મોર્ટગેજ કરાયા અપાતા 'હેર-કટ' જેવી જ છે અને તેથી બેન્કો તથા ઓફર કરવાના રહેશે. હાલમાં જ હોય તથા જામીનગીરીની ઓફર બેન્કોના રૂા.૨૦ લાખથી દ્રીબ્યુનલ બન્નેનું ભારણ વધી ગયુ લોક સભામાં એક પ્રશ્નના સ્થિતિના આધારે નિર્ણય લેવાનો રૂા.૧ કરોડ સુધીના ધીરાણમાં છે. આ કેસમાં હવે સમાધાન જવાબમાં જણાવાયું હતું કે ડેટ રહે છે.ડેટરીકવરી ટ્રીબ્યુનલ કોઈ પણ કરવા સૂચના આપી છે.

જેઓ એનપીએ થયા હોય અને વ્યાજ-પેનલ્ટી વિ. માં ચોકકસ કેસ પેન્ડીંગ છે. અગાઉ રૂા.૪.૪૩ પ્રકારના કેસ વધી રહ્યા છે.

ભૂમિકા પર લઈ જઈને વનટાઈમ રીકવરી ટ્રીબ્યુનલ પાસે ફેબ્રુઆરી 'હેરકટ' કે સમાધાન યોજના હાલ આ રેન્જના ધિરાણમાં સેટલમેન્ટ હેઠળ બાકીદારોને ૨૦૨૩ની સ્થિતિએ ૧.૫૮ લાખ ઓફર કરતી નહી હોવાથી આ

्रवेनारीको हिमान्द हिमान्द नोडिक/नाडीका म

ટ્રીબ્યુનલ દ્વારા બેંકો અને કોર્પોરેટ ક્ષેત્રનાં જે તે સંચાલકો વચ્ચે 'હેરકટ'ના નામે જંગી રકમનું ધીરાણ માફ કરે છે અને તેમાં સેટલમેન્ટ ટ્રીબ્યુનલ સહીતની ભમિકા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.જયારે નાના ધીરાણમાં ડેટ-ટ્રીબ્યુનલને કોઈ રાહત આપવાની સતા નથી અને તેથી જ કેન્દ્ર સરકારે હવે આ પ્રકારના

નામ બદલેલ છે

મેં મારું નામ વીરલ (એસએસસી) વિરલ પંચાસરા (એચએસસી) પંચાસરા વિરલ કૌશિકભાઈ (બી.કોમ.) માંથી વિરલ કૌશિકભાઈ પંચાસરા રાખેલ છે. સરનામું બી-૧/૬૨, હરિદ્વાર સોસાયટી-૨, સાગર હોલ સામે. રાજકોટ-૩૬૦૦૦૪

ધીરાણની વસુલાત ઝડપી બને અને બેન્ક તથા ટ્રીબ્યુનલની કામગીરી ઘટે તે માટે આ વનટાઈમ સેટલમેન્ટ યોજના ઓફર કરવા જણાવ્યું છે.

PUBLIC NOTICE - PIDILITE INDUSTRIES LIMITED Regd. Office: 7th Floor, Regent Chambers, Jamnalal Bajaj Marg, 208 Nariman Point, Mumbai 400021.

NOTICE is hereby given that the certificate for the under mentioned securities of the Company has been lost/misplaced and the holder of the said securities/applicant has applied to the Company to issue duplicate certificate. Any person who has a claim in respect of the said securities should lodge such claim with the Company at its Registered Office within 15 days from this date, else the Company will proceed to issue duplicate certificate without further intimation.

Name of Shareholder	Kind of Securities	Face Value	No. of Securities	Folio No.	Share Certificate No.	Distinctive Number
SHARAD H GAJJAR	EQUITY SHARES	Rs.1/-	800	PIS 0000609	00201200	3980951 To 3981750
Place : Ahm	edabad. Da	te : 29		SHARA	D H GAJJAR	

GAUTAM GEMS LIMITED CIN: L36911GJ2014PLC078802 ess : 3rd Floor, Office : 301, Sumukh Super Compound, Vasta Devadi Road, Surat - 395004 STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023

Sr. No		Quarter ended on 31-03-2023 Audited	Quarter ended on 31-12-2022 Unaudited	Quarter ended on 31-03-2022 Audited	Year ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2022 Audited
1	Total Income	2983.17	6181.07	6766.67	9164.24	18020.16
2	Net Profit for the year before tax	37.55	86.11	44.51	48.56	73.14
3	Net Profit for the year after tax	28.05	66.11	62.93	35.41	52.08
4	Total Comprehensive Income for the year	0.00	0.00	0.00	0.00	0.00
5	Paid up Equity Share Capital	1006.71	1006.71	1006.71	1907.73	1006.71
6	Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each)	3+4	**			
	Basic & Diluted	0.28	0.66	0.63	0.19	0.52

of Directors at their meeting held on 29-05-2023 (B) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. (C) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (D) The figures for the previous year/periods are re-arranged / re-grouped, wherever considered necessary.

For and on behalf of Gautam Gems Limited sd/- Gautam P. Sheth, Managing Director - DIN: 06748854 Place : Surat || Date : 30/05/2023

આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ- ઇન્ડિયન રેયોન કંપાઉન્ડ, વેરાવળ, ગુજરાત-૩૬૨૨૬૬ શાખા ઓફિસઃ જી કોર્પોરેશન ટેક પાર્ક, કાસારવડાવલી, ઘોડબંદર રોડ, થાણે, -૪૦૦૬૦૭ (મહારાષ્ટ્ર)

ડિમાન્ડ નોટિસ

(ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩(૧) હેઠળ)

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફોયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩(૨) હેઠળ વૈકલ્પિક બજવણી

આથી નીચે ઉલ્લેખ કરેલ દેણદારોને અત્રે નોટિસ આપવામાં આવે છે કે તેઓ તેમણે આદિત્ય બિરલા હાઉસિંગ કાઇનાન્સ લિમેટેડ (એબીએચએકએલ) પાસેથી મેળવેલ ક્રેડિટ સવિધાની પરત ચકવણીમાં ક્સર કરેલ છે. તેમને લોન ખાત આરબીઆઈની ગાઇડલાઇન્સ મુજબ નોન-પરકોર્મિંગ એસેટ તરીકે કંપનીના ચોપડે વર્ગીકૃત થયેલ છે. તે પછી એબીએચએકએલએ ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓક ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ એક સિક્યોરિટ ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ (સરફૈસી કાયદો) ના સેક્શન ૧.૩(૨) હેઠળ સદર દેશદારોના છેલ્લા પરિચિત સરનામે ડિમાન્ડ નોટિસો મોકલી હતી જેમાં એમને આખીય બાકી રકમ એની પરના કરાર આધારિત દરે થનાર વ્યાજ સહિત અને આકસ્મિક ખર્ચ કોસ્ટ, ચાર્જેસ વગેરે જે સદર ડિમાન્ડ નોટિસોમાં જ્લાવેલ છે તે સહિત ચૂકવી જવા જ્લાવેલ. તેમ છતાં ડિમાન્ડ નોટિસ ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (સરફૈસી નિયમો) ના નિયમ ૩ મુજબ પણ બજવવામાં આવે છે.

નં.	દેણદાર/સહ-દેણદાર અને જામીનદાર/સહજામીનદારનું નામ અને સરનામું અને ધિરાણ ખાતા નંબર	તારીખ	નોટિસની તારીખ	ાંડમાન્ડ નાાટસ/ તારાબ મુજબ લેણી નીકળતી રકમ
વ	૧. વસંતકુમાર મફતભાઈ પટેલ યુનિટ નં. બી-૧૯, આનંદ સાગર કો. ઓપ.હા.સો., કરસનપુરા રોડ, પટેલ વાડી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૩૮૭૬૨૦. ૨. રેખાબેન વસંતભાઈ પટેલ યુનિટ નં. બી-૧૯, આનંદ સાગર કો. ઓપ. હા.સો., કરસનપુરા રોડ, પટેલ વાડી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૩૮૭૬૨૦. ૩. શ્રી એન્જિનિયરિંગ વર્સત, યુનિટ નં. બી-૧૯, આનંદ સાગર કો. ઓપ.હા.સો., કરસનપુરા રોડ, પટેલ વાડી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૩૮૭૬૨૦. ૪. અધિનભાઈ પટેલ યુનિટ નં. બી-૧૯, આનંદ સાગર કો. ઓપ.હા.સો., કરસનપુરા રોડ, પટેલ વાડી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૩૮૭૬૨૦. ૪. અધિનભાઈ પટેલ યુનિટ નં. બી-૧૯, આનંદ સાગર કો. ઓપ.હા.સો., કરસનપુરા રોડ, પટેલ વાડી પરેન કપડવંજ, ખેડા, ગુજરાત-૩૮૭૬૨૦. ૧. મીલિકભાઈ વસંતભાઈ પટેલ ૧૬૦૯ પટેલ વાડી પરેમશાળા પાસે, આનંદ સાગર સોસાયટી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૩૮૭૬૨૦ હો. મોહા સાગર સોસાયટી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. સાગર સોસાયટી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. સાગર સોસાયટી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. શ્રી એન્જિનિયરિંગ વર્સ્સ ૧૯૦૯ પટેલ વાડી પરેમશાળા પાસે, આનંદ સાગર સોસાયટી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. હો. વિસ્તા પાસે કપડવંજ, ખેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. શ્રી એન્જિનિયરિંગ વર્સ્સ ભાવળાવાળા છત્ત કંપાઉન્સ, મોડા સ્ટેડ કરા પટેલ વાડી પરેમાળા પાસે, આનંદ સાગર સોસાયટી પાસે, કપડવંજ, ખેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. હો. વિસ્તા પાઇલ પડેલ વાડી પરેમાળા પાસે આનંદ સાગર સોસાયટી પાસે, કપડવંજ, બેડા, ગુજરાત-૭૮૭૬૨૦ હો. ના હો. પટેલ લોડી પરેમાળા પાસે આનંદ સોસાયટી પાસે કરા પડેલ હો. પટેલ લોડી પાસે પાઇલ હો. હો. ગુજરાત-૭૮૭૬૨૦ હો. અધિનભાઈ પટેલ મોટા પટેલવાડા, પટેલ વાડી પરે માટા પટેલ હો. પટેલ હો. ગુજરાત-૭૮૭૬૨૦ હો. અધિનભાઈ પટેલ મોટા પટેલવાડા, પટેલ વાડી પટેલ હો. હો. ગુજરાત-૭૮૭૬૨૦ હો. મોડા પટેલવાડા, મોડા પટેલ વાડી પટેલ હો. હો. ગુજરાત-૭૮૭૬૨૦ હો. મોડા પટેલ લોડી પટેલ હો. પટેલ હો. સાગર હો.	१०-० ५- २०२३	23-04 2023	રૂ.૩૫,૮૦,૯૧૦.૮૮/- (એકે રૂપિયા પાંત્રીસ લાખ એશી હજાર વપસો દસ અને પૈસા અદ્ભક્ષાસી પૂરા) ભાકી નીકળતી મુક્લ, એરિયર્સ (મુદતવીતી ચાર્જેસ સહિત) અને ૧૯-૦૫-૨૦૨૩ સુધીના વ્યાજ સહિત મુજબ

અને એની સીમાઓ: ઉત્તરે: રોડ, દક્ષિણે: બાઉન્ડરી, પૂર્વે: યુનિટ નં. બી /૧૮, પશ્ચિમે: યુનિટ નં. બી /૨૦

ı	₂	૧.ધવલકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લેટ નં∷ૈ-૩૦૩, મહિમા રેસિકોમ… રે.સ.નં. ૨૫૯, શ્રીજી વિલા સામે, એર-ફોર્સ સ્ટેશન પાછળ, વડોદરા, ગુજરાત-	1
1	`		1 ~
1		૩૯૦૦૧૪ ૨. ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લેટ નં.ેં-૩૦૩, મહિમા રેસિકોમ. , રે.સ.નં. ૨૫૯, શ્રીજી વિલાસામે, એર-ફોર્સ સ્ટેશન પાછળ, વડોદરા, ગુજરાત-	
ı		🛮 ૩૯૦૦૧૪, ૩.ધવલકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ છ-૨, લક્ષ્મીનારાયણ -૧, પાદરા, પાદરા(એમ), વડોદરા, ગુજરાત-૩૯૧૪૪૦. ૪. ભૂપેન્દ્રભાઈ	
ı		🛮 પટેલ છ-૨, લક્ષ્મીનારાયણ-૧, પાદરા, પાદરા(એમ), વડોદરા, ગુજરાત-૩૯૧૪૪૦. પ. ધવલકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ કેર ઓફ અંબે ટ્રેડિંગ, દુકાન	
ı		નં.૧,કૃષ્ય કોમ્પ્લેક્સ, મકરપુરા, વડોદરા, ગુજરાત-૩૯૦૦૧૦	
1		ધિરાણ ખાતા નંબર LNBAROHI -09210100996 અને LNBAROHI -09210100995	

તારીખ ૨૩-૧૧-૨૦૨૧ની જૂની નોટિસ પાછી ખેંચેલ છે આ પ્રકાશન લાગુ પડતી નોટિસ તરીકે ગણવું.

२०२३

સુધીના વ્યાજ સહિત મુજબ સ્થાવર મિલકત/ ગિરવે મિલકતોનું વર્શનઃ મોજે મકરપુરા, રે.સ.નં. ૨૫૯, ટીપી સ્કીમ નં. ૩૭, ફાઇનલ પ્લોટ નં. ૧૪/૨, રજિસ્ટ્રેશન જિલ્લો અને પેટા જિલ્લો વડોદરા, જિલ્લો વડોદરા ખાતે આવેલ મહિમા રેસિકોમ તરીકે જાણીતા પ્રોજેક્ટમાં મિલકત તે ફ્લેટ

રૂ.૧૬,૬૧,૦૯૨.૦૦/-(અંકે રૂપિયા સોળ લાખ એકસર

હજાર બાણું પુરા) બાકી નીકળતી

મુદલ,એરિયર્સ (મુદતવીતી ચાર્જેસ સહિત) અને ૦૫.૦૫.૨૦૨૩

1			
	B	9.મીનાક્ષીબેન એમ. જત (સ્વ. મહેન્દ્ર કુમાર જતના કાયદેસરના ઉપલબ્ધ વારસની ક્ષમતાએ)કલેટ નં.આર-૨૦૨, બ્લ્યુ આઇરિસ-૨, આરએએક કેમ્પ સામે, વસાલ રિંગ રોડ, વસાલ, અમદાવાદ, ગુજરાત- ૩૮૨૪૧૮. ૨. મીનાક્ષીબેન એમ. જત કલેટ નં.આર-૨૦૨, બ્લ્યુ આઇરિસ-૨, આરએએક કેમ્પ સામે, વસાલ રિંગ રોડ, વસાલ, અમદાવાદ, ગુજરાત- ૩૮૨૪૧૮. ૩. મીનાક્ષીબેન એમ. જત (સ્વ. મહેન્દ્ર કુમાર જતના કાયદેસરના ઉપલબ્ધ વારસની ક્ષમતાએ) કલેટ નં. ૧૦૨, યાદવ રેસિડન્સી, આરએએક કેમ્પ પાસે, વસાલ રિંગ રોડ, વસાલ, અમદાવાદ, ગુજરાત- ૩૮૨૪૧૮ ૪. શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ સ્વેઠ નં.આર-૨૦૨, બ્લ્યુ આઇરિસ-૨, આરએએક કેમ્પ સામે, વસાલ રિંગ રોડ, વસાલ, અમદાવાદ, ગુજરાત- ૩૮૨૪૧૮ ૪. શ્રી ભગવતી ઇન્ડસ્ટ્રીઝ એક-૨-૧ ફેઝ ૪, શકરીબા ઇન્ડ. એસ્ટેટ, ઇન્ડો જર્મન ટ્રેલ્સ લિ. પાછળ, વટવા જીઆઇડીસી અમદાવાદ, ગુજરાત ૩૮૪૪૫ ૬. મીનાક્ષીબેન એમ. જત કલેટ નં. ૧૦૨, યાદવ રેસિડન્સી, આરએએફ કેમ્પ પાસે, વસાલ રિંગ રોડ, વસાલ,	9
1		અમદાવાદ, ગુજરાત- ૩૮૨૪૧૮ ૮.મીનાક્ષીબેન એમ. જત (સ્વ. મહેન્દ્ર કુમાર જતના કાયદેસરના ઉપલબ્ધ વારસની ક્ષમતાએ) ૧૬, જલારામ પાર્ક, ઘોડાસર,	
- 1		અમદાવાદ સિટીસ ગુજરાત ૩૮૦૦૫૦.	

ધિરાણ ખાતા નંબર LNAHM0HL-07200068318 અને LNAHM0HL-07200068319

૩૦૩, ૩જે માળે, માપણી ૪૮.૪૮ ચો.મી.(કાર્પેટ એરિયા), વિંગે-, ના તમામ હક્ક અને હિસ્સા. સીમાઓ નીચે મુજબ છેઃ પૂર્વેઃ ફ્લેટ નં. ૩૦૨, પશ્ચિમેઃ ૧૮ મી. રોડ, ઉત્તરેઃ ફ્લેટ નં. ૩૦૪, દક્ષિણેઃ ટાવર-એચ

3.29, 89, 890/ ૧૨.૦૫.૨૦૨૩ સુધીન વ્યાજ સહિત મુજબ

(અંકે રૂપિયા એકવીસ લાખ એકસઠ હજાર છસ સિત્તેર પૂરા) બાકી નીકળતી મુદલ,એરિયર્સ (મુદતવીતી ચાર્જેસ સહિત) અને

સ્થાવેર મિલકત/ ગિરવે મિલકતોનું વર્શનઃ મોજે વસાલ, તાલુકો વટવા, રજિસ્ટ્રેશન જિલ્લો અમદાવાદ અને પેટા જિલ્લો અમદાવાદ, ગુજરાત-૩૮૨૪૧૮ ખાતે આવેલ મોજે વસાલ (સીમ) તાલુકા ખાતે આવેલ, ક્રીસોલ્ડ બિનખેત જમીન પર બંધાયેલ તે સર્વે નં ૭૫૯. ૭૬૦/૧. ૭૭૭. ૭૭૮ અને ૮૦૩ પર આવેલ. ટીપી સ્કીમ નં. ૧૧૪ (વસાલ-રામોલ)ના કાઇનલ પ્લોટ નં. ૨૦/૧/૧ ધારક જમીનનો ભાગ (એટલે કે કાઇનલ પ્લોટ નં. ૨૦/૧/૧). નો સબ પ્લોટ નં. ૩) બનતા હિસ્સા પર વિકસાવેલ બ્લ્ય આઇરિસ-૨ પ્રોજેક ાપલી ૭૨૮૧, ૨૪ ચો.મી.માં બ્લોક નં. આરના રજે માળે, ફ્લેટ નં. આર-૨૦૨ માપલી ૪૮ ચો.મી.મિલકતના તમામ હક્કહિસ્સા, એની સીમાઓઃ પૂર્વેં: રોડ, પશ્ચિમેઃ ફ્લેટ નં.આર-૨૦૩,6ત્તરેઃ ફ્લેટ નં. આર-૨૦૧, દક્ષિક્ષેઃ ફ્લેટ નં. એસ- ૨૦૩.

આથી અત્રે અમે અહી જણાવેલ દેશદારને આ નોટિસની તારીખથી દિન ૧૦માં બાકીની રકમ તેની પર થનાર આગળના વ્યાજ વત્તા કોસ્ટ, ચાર્જેસ, ખર્ચાઓ વગેરે સહિત ચૂકવી જવા જણાવીએ છીએ. એમાં નિષ્ફળ ગયેથી સંપૂર્ણપણે તમારા ખર્ચે અને જોખમે ગિરવે મિલકત જપ્ત કરવા એટલું જ નહીં એનો કબજો લેવા તથા સિક્યોર્ડ અસ્ક્યામતો વેચાલ છૂટા છીએ. મહેરબાની કરીને નોંધ લેશો કે કંપનીની લેખિત પૂર્વમંજૂરી વિના ઇપરોક્ત સિક્યોર્ડ અસ્ક્યામતો વેચાલ, લિઝ કે અન્ય કોઈ રીતે તબદિલ કરવા તમને સરફૈસી કાયદાના સેકશન ૧૩(૧૩) મુજબ મનાઈ કરમાવવામાં આવે છે. સદર સેક્શનનો કોઈ પણ રીતે ભંગ થવાથી

સરફૈસી કાયદાના સેક્શન ૨૯ અને /અથવા આ સંબંધે અન્ય કોઈ કાયદાની જોગવાઈ અન્વયે. તમને સંજા થઈ શકે છે. સિક્યોર્ડ અસ્ત્ર્યામત છોડાવવાના સંદર્ભે મળવાપાત્ર સમયમર્યદા અંગે કાયદાના સેક્શન ૧૩ના સબસેક્શન (૮)નીજોગવાઈ તરફ દેષદારોને ધ્યાન દોરવામાં આવે છે કે જો એબીએચએકએલને લેણી થતી રકમ તમામ કોસ્ટ. ચાર્જેસ અને એબીએચએકએલને થયે

ખર્ચાઓ સહિત વેચાલ કે તબદિલીની નક્કી થયેલ તારીખ અગાઉ એબીએચએકએલને ચૂકવી દેવામાં આવશે તો એબીએચએકએલ સિક્યોર્ડ અસ્ક્યામત વેચાલ કે તબદિલ નહીં કરે અને એબીએચએકએલ દ્વારા સિક્યોર્ડ અસ્ક્યામત વેચાલ કે તબદિલ માટે અન્ય કોર્દ

તા. ૩૧-૦૫-૨૦૨૩

સહી /- અધિકૃત અધિકારી



Future Full of Colours (CIN - L24231GJ1998PLC034094)

Read. Office: 7th Floor, Hasubhai Chambers, Opp. Town Hall, Ellisbridge, Ahmedabad- 380006 Phone No. (O) 079-26574371/72/73, (F) 079-26574374, Email: info@kiriindustries.com website: www.kiriindustries.com

(Rs. in Lakhs except per share date						
		Quarter Ended	t	Year Ended		
Particulars	(31/03/2023)	(31/12/2022)	(31/03/2022)	(31/03/2023)	(31/03/2022)	
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)	
Total income from Operations	22,521.76	20,405.91	41,745.65	94,840.14	1,49,889.81	
Net Profit/ (Loss) for the period(before Tax,						
Exceptional and/or Extraordinary items)	(1,601.43)	(3,094.61)	1,200.00	(8,933.36)	6,832.49	
Net Profit/ (Loss) for the period before tax						
(after Exceptional and/or Extraordinary items)	(1,601.43)	(3,094.61)	1,200.00	(8,933.36)	6,832.49	
Net Profit/ (Loss) for the period after tax						
(after Exceptional and/or Extraordinary items)	(1,834.84)	(3,400.92)	922.93	(10,496.55)	5,291.65	
Total Comprehensive Income for the period						
[Comprising Profit/ (Loss) for the period (after tax)						
and Other Comprehensive Income (after tax)]	(6,098.73)	5,397.31	9,070.21	10,714.81	38,844.02	
Paid up Equity Share Capital	5,183.42	5,183.42	5,183.42	5,183.42	5,183.42	
Reserves (excluding Revaluation Reserve) as shown						
in the Audited Balance Sheet of the previous year				2,62,745.21	2,52,080.64	
Earnings Per Share (Face value of Rs. 10/- each)						
Basic:	(11.77)	10.42	18.00	20.67	95.49	
Diluted:	(11.77)	10.42	17.50	20.67	74.94	

				(F	Rs. In Lakhs	
		Quarter Ended	t	Year Ended		
Particulars	(31/03/2023)	(31/12/2022)	(31/03/2022)	(31/03/2023)	(31/03/2022)	
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)	
Total Income from Operations	15,793.02	13,957.10	32,880.93	62,488.10	1,13,866.63	
Net Profit/ (Loss) for the period before tax						
(after Exceptional and/or Extraordinary items)	(2,676.47)	(3,612.40)	(536.01)	(13,592.06)	(1,495.58)	
Net Profit/ (Loss) for the period after tax						

(after Exceptional and/or Extraordinary items) Note:

1. The above is an extract of the detailed audited financial results ("Results") filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (www.bseindia.com & www.nseindia.com) as well as on the Company's website

(2,659.18)

(3.585.72)

2. The above Result were reviewed by the Audit committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 30, 2023.

By order of the Board of Directors

(343.38) (13,420.82)

For Kiri Industries Limited Manish Kiri **Chairman & Managing Director** AksharChem (India)

Regd. Office: "Akshar House", Chhatral Kadi Road, Indrad – 382 715, Mehsana. Tel: +91 2764 233007/08/09/10 Fax: +91 2764 233550 Website: www.aksharchemindia.com, e-mail ID: cs@aksharchemindia.com, CIN: L24110GJ1989PLC012441

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2023

			Rs. in lak	hs except EPS
Sr. No.	Particulars	Quarter Ended 31-03-2023	Year Ended 31-03-2023	Quarter Ended 31-03-2022
1.	Total Income from Operations	6,473.83	33,467.86	11,195.63
2.	Net Profit for the period (before tax and exceptional items)	(208.04)	(49.90)	(91.40)
3.	Net Profit for the period before tax (after exceptional items)	(208.04)	(49.90)	(91.40)
4.	Net Profit for the period after tax (after exceptional items)	(196.52)	(94.21)	268.43
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	5.85	(1.10)	(10.59)
6.	Paid up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	803.31	803.31	803.31
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	-	27,033.16	-
8.	Earnings per share (for Continuing and discontinued operations) Basic Diluted	(2.45) (2.45)	(1.17) (1.17)	3.37 3.37

Notes:1. The above audited financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on May 30, 2023. 2. The above is an extract of the detailed format of Audited Quarter and Year ended Financial Results filed with the Stock Exchanges under Requilation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements). Regulations, 2015. The full format of the Audited Quarter and Year ended Financial Results will be available on the Stock Exchange website namely www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.aksharchemindia.com. 3. The Board of Directors have recommended a final dividend of Rs. 0.50 per equity share (5% of the face value of Rs. 10 each) for the financial year ended March 31, 2023 subject to the approval of shareholders at the ensuing Annual General Meeting.

For and on behalf of Board of Directors AksharChem (India) Limited

Place: Ahmedabad Date: May 30, 2023 Mrs. Paru M. Jaykrishna Chairperson & Mg. Director

WE GENERATE SMILES FOR ALL OUR STAKEHOLDERS.



73%

80%

DISBURSEMENT GROWTH FY23 vs FY22

AUM GROWTH REVENUE GROWTH NET PROFIT GROWTH FY23 vs FY22

FY23 vs FY22 FY23 vs FY22

(₹ in Lakhs)

			Quarter Ended	Year Ended		
Sr. No.	Particulars	31.03.2023 Audited	31.12.2022 Unaudited	31.03.2022 Audited	31.03.2023 Audited	31.03.2022 Audited
				Consolidated		
1	Total Income from Operations	14,931.24	10,303.87	7,581.44	42,390.12	23,500.56
2	Net Profit / (Loss) (Before Tax & Exceptional items)	4,883.45	2,939.06	2,207.65	12,495.37	4,551.82
3	Net Profit / (Loss) Before Tax (After Exceptional items)	4,883.45	2,939.06	2,207.65	12,495.37	4,551.82
4	Net Profit / (Loss) After Tax (After Exceptional item)	3,619.95	2,197.53	1,628.06	9,381.13	3,172.28
5	Total Comprehensive Profit / (Loss) after tax and Other Comprehensive Income (after tax)]	3,350.90	2,126.14	1,057.94	8,900.25	2,582.32
6	Equity Share Capital	849.23	849.23	849.16	849.23	849.16
7	Reserve excluding Revaluation Reserves	35,719.82	32,305.58	20,419.45	35,719.82	20,419.45
8	Securities Premium Account	6,903.37	6,898.26	6,897.96	6,903.37	6,897.96
9	Outstanding redeemable Preference Shares	31.10	31.10	-	31.10	-
10	Paid up Debt Capital / Outstanding Debt	1,60,441.10	1,63,749.01	98,969.05	1,60,441.10	98,969.05
11	Earnings per share					
	(a) Basic Earning Per Share	42.63	25.88	19.17	110.47	37.36
	(b) Diluted Earning Per Share	39.47	25.87	19.16	107.28	37.35
12	Debt Equity Ratio	4.39	4.94	4.65	4.39	4.65
13	Networth	36,569.05	33,154.81	21,268.61	36,569.05	21,268.61
14	Capital Redemption Reserve	-	-	-	-	-
15	Debenture Redemption Reserve	-	-	-	-	-
16	Debt Service Coverage Ratio	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
17	Interest Service Coverage Ratio	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
		Standalone				
18	Net sales / Income from Operations	2,764.04	2,368.73	1,989.29	9,439.24	6,326.14
19	Profit Before Tax	969.71	875.61	1,000.51	3,758.95	2,129.96
20	Profit After Tax	705.50	669.39	763.72	2,836.15	1,623.44

NOTE: The above is an extract of the detailed format of quarterly / yearly financial results filed with the Stock Exchanges under Regulation 33 and 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly / yearly financial results are available on the Stock Exchange websites: (www.bseindia.com and

For and on behalf of the Board of Directors

Vice Chairman & Managing Director (DIN: 00011814)

Jayendra Patel

Place: Ahmedabad Date: 30.05.2023

w.nseindia.com) and on the Company's website (www.armanindia.com)



MICROFINANCE | MSME LOANS | 2W LOANS

ARMAN FINANCIAL SERVICES LIMITED

Registered Office: 502-503, SAKAR III, OPP. OLD HIGH COURT, OFF. ASHRAM ROAD, AHMEDABAD-380014 Phone: +91-79-40507000, 27541989; E-mail: finance@armanindia.com; Website: www.armanindia.com; CIN: L55910GJ1992PLC018623



Date: May 30, 2023

Place: Ahmedabad













(931.67)



















ART NIRMAN LIMITED

CIN: L45200GJ2011PLC064107

Registered Office: 410, JBR Arcade, Science City Road, Sola, Ahmedabad, Gujarat-380060. (0): 079 27710511/12 (E): cs@artnirman.com (W): www.artnirman.com

Extract of Audited Standalone Financial Results for the Quarter and year ended 31st March, 2023.

Particular	Quarter	r ended on 31.0	Year ended		
	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)
Total Income from operation	1170.00	101.95	644.05	1971.68	3682.50
Net Profit/Loss for the period (before tax, exceptional items and/or extraordinary items)	36.14	(10.94)	(383.97)	8.36	(1100.87)
Net Profit/Loss for the period (before tax, after exceptional items and/or extraordinary items)	36.14	(10.94)	(383.97)	8.36	(1100.87)
Net Profit/Loss for the period (after tax, exceptional items and/or extraordinary items)	39.01	(10.94)	(383.00)	11.22	(1099.70)
Total comprehensive income for the period (comprising profit/loss for the period after tax and other comprehensive income after tax)	39.01	(10.94)	(383.00)	11.22	(1099.70)
Paid up Equity Share Capital (face value of INR 10/- each)	2495.6	2495.6	2495.6	2495.6	2495.6
Earning per shares 1. Basic 2. Diluted	0.16 0.16	(0.04) (0.04)	(1.53) (1.53)	0.04 0.04	(4.41) (4.41)

Notes:

Date: 30.05.2023

- 1. The above Audited financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meeting held on 29.05.2023.
- 2. 'The figures of the previous period/year have been regrouped / recast / reclassified wherever considered necessary to conform to the current year's presentation.
- 3. The above is an extract of the detailed format of Audited Financial Results filed by the Company with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations. 2015. The full format of Audited Financial Results are available on the company website www.artnirman.com as well as on the the stock exchange website viz. www.nseindia.com.

For ART NIRMAN LTD

Ashokkumar R. Thakker Place: Ahmedabad **Chairman & Managing Director**

CONTIL INDIA LIMITED

CIN NO: L74110GJ1994PLC023444

Regd.Off: 811, Siddharth Complex, R.C.Dutt Road, Alkapuri, Baroda - 390 007, Gujarat, India. Ph.: 912652342680/2350863, Fax: 2342680, Email: office@contilgroup.com

STATEMENT OF AUDITED FINANCIAL RESULT FOR QUARTER AND YEAR ENDED 31St MARCH 2023

SR.		Q	UARTER END	ED	YEAR ENDED	YEAR ENDED	
NO.	PARTICULARS	31/03/2023	31/12/2022	31/03/2022	31/03/2023	31/03/2022	
		AUDITED	UNAUDITED	AUDITED	AUDITED	AUDITED	
1	INCOME						
	Revenue From Operation	47,007.26	51,862.91	46,612.74	1,96,749.73	1,66,978.93	
	Other Income	443.50	592.63	2,863.87	2,778.59	7,617.18	
	Total Revenue	47,450.76	52,455.54	49,476.61	1,99,528.32	1,74,596.11	
2	Expenses						
	a) Pruchase of traded Goods	39,004.90	40,923.82	44,968.62	1,66,445.24	1,57,329.02	
	b) Change in Inventories of finish goods, WIP	1,546.25	760.81	(4,457.38)	471.87	(0,808.81)	
	C) Operating Expenses	4,204.37	5321.24	3329.65	17129.172	9899.64	
	d) Employee Benefit Expenses	565.10	848.1	731.10	2,327.90	2,447.60	
	e) Finance Cost	55.22	64.15	48.89	282.71	181.96	
	f) Depraciation and Amortisation Expense	61.10	54.02	53.29	221.79	195.79	
	g) Other Expense	1,315.88	1,424.19	3,721.16	4,020.63	5,574.97	
	Total Expense	46,752.83	49,396.33	48,394.88	1,90,899.32	1,66,820.17	
3	Profit Before Tax	697.93	3,059.21	1,081.73	8,629	7,775.94	
4	Tax Expenses						
	1) Current Tax	405.82	795.40	(2,024.34)	2,467.90	2,024.34	
	2) Deferred Tax	11.19	-	2.60	11.19	(2.60)	
	3) Income Tax of Earlier Year	(84.36)	-	442.36	(84.36)	(442.37)	
5	Profit / (Loss) for the Period	365.29	2,263.81	(497.65)	6,234.28	6,196.56	
6	Other Comprehensive Income/(Loss)						
	items that will not to be reclassified to profit of loss						
	1). Net Loss/Gai on equity Instruments through other						
	comprehensive Inocme	(1,111.82)	1,595.74	(566.21)	338.09	(556.21)	
	2). Inocme Tax effect on above	289.08	414.9	694.21	(87.90)	694.21	
7	Total Comprehensive Income for the Period	(457.45)	3,444.65	369.65	6,484.47	6,324.57	
	Paid up Equity Share Capital						
8	(Face Value of Rs. 10/ Each.	30,944.00	30,944.00	30,944.00	30,944.00	30,944.00	
9	Reserve & Surplus				42,749.02	36,263.98	
	Earning Per Share of Rs. 10 each						
	a) Basic	0.12	0.73	(0.16)	2.01	2.00	
	b) Diluted	0.12	0.73	(0.16)	2.01	2.00	

NOTE: (1) The above result has been audited by statutory auditor, recommended by audit committee and approved by the Board of Director of the Company at their Meeting held on 26th May 2023. (2) The Previous Period figures have been regrouped/reclassified wherever necessary to confirm to the classification for this quarter. (3) The Company is engaged in the business of Merchant Export

Place: BARODA. Date: 26th May 2023.

CONTIL INDIA LIMITED K.H.CONTRACTOR (DIRECTOR) DIN: 00300342

	Date . Zotil May 2023. K.H.CONTRACTOR (DIRECTOR) DIN : 00300342						
ST	STATEMENT OF ASSETS & LIABILITIES FOR THE PERIOD ENDED MARCH 31, 2023						
Par	t II			Figures in Rs`000			
SR.	PARTICUI	ADS	AS AT 31ST MARCH 2023 AS AT 31ST MARCH 2022				
NO.	PANTICOL	Ano	Audited	Audited			
А	ASSETS						
1	Non - Current Assets						
Ι΄	Property, Plant & Equipment		1,840.57	1,858,38			
	Financial Assets		1,510.01	,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,			
	- Investments		14,866.54	13,598.64			
	- Loans		170.00	170.00			
	Total - Non Current Assets		16,877.11	15,627.02			
2	Current Assets						
	Inventories		14,273.33	14,745.19			
	Financial Assets						
	Trade Reveivables		50,142.12	51,105.27			
	Cash & Cash Equivalents		1,494.67	1,194.97			
	Bank Balance other then abov Investments	е	2,000.03	2,000.03 0.44			
	Other Current Assets		0.44 3,317.70	6,731.44			
	Total - Current Assets		71,228.28	75,777.34			
	TOTAL - ASSETS		88,105.39	91,404.36			
В	EQUITY & LIABILITIES						
1	Equity						
' '	Equity Share Capital		30.944.00	30,944.00			
	Other Equity		42,748.46	36,263.99			
	Total - Equity		73,692.46	67,207.99			
2	LIABILITIES						
	Non Current Liabilities						
	Financial Liabilities						
	Other Financial Liabilities		800.17	- 701.08			
	Deferred Tax Liabilities Total Non - Current Liabilities		800.17	701.08			
ارا			000.17	701.00			
3	Current Liabilities						
	Financial Liabilities - Trade Payables		9,465.23	19,340.98			
	Other Current Liabilities		3,402.75	3,159.27			
	Current Tax Liabilities (Net)		744.79	995.05			
	Total - Current Liabilities		13,612.77	23,495.29			
		Sub Total - Current Liabilities	88,105.39	91,404.36			
	Date: 26/05/2023		CONTIL INDIA	A LIMITED			
	Place: BARODA		K.H.CONTRACTOR (DIREC				

GAUTAM GEMS LIMITED CIN: L36911GJ2014PLC078802 ess: 3rd Floor, Office: 301, Sumukh Super Compound, Vasta Devadi Road, Surat - 395004 STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023 (Rs. in Lakhs)

	QUARIER AND ILAK ENDED C	N 3131 MARCH, 2023			(INS. III LANIIS)	
Sr. No		Quarter ended on 31-03-2023 Audited	Quarter ended on 31-12-2022 Unaudited	Quarter ended on 31-03-2022 Audited	Year ended on 31-03-2023 Audited	Year ended on 31-03-2022 Audited
1 2 3 4 5 6 7	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.10/- each) Basic & Diluted	2983.17 37.55 28.05 0.00 1006.71 	6181.07 86.11 66.11 0.00 1006.71 	6766.67 44.51 62.93 0.00 1006.71 	9164.24 48.56 35.41 0.00 1907.73 	18020.16 73.14 52.08 0.00 1006.71

Notes: (A) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Boar of Directors at their meeting held on 29-05-2023 (B) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. (C) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (D) The figures for the previous year/periods are re-arranged / re-grouped, wherever considered necessary.

Place : Surat || Date : 30/05/2023

For and on behalf of Gautam Gems Limited sd/- Gautam P. Sheth, Managing Director - DIN: 06748854

इण्डियन ओवरसीज बैंक Indian Overseas Bank Good People To Grow with

Indian Overseas Bank - Karelibaug Branch 1st Floor Status Complex, Opposite Amrapali, Karelibaug, Vadodara, Gujarat. Ph: 0265-2461359, Email: iob1869@iob.in

Under Section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Act 2002 (SARFAESI Act) read with Rule 3(1) of the Security Interest (Enforcement) Rules, 2002 (Rules)

 Whereas the undersigned being the Authorized Officer of Indian Overseas Bank under SARFAESI Act and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3, issued Demand Notice under Section 13(2) of the said Act, calling upon the Borrowers/ mortgagors/ guarantors Mr. Narsinh Rimabhai Rathva S/o Mr. Rimabhai Rathva (Borrower cum Mortgagor) listed hereunder (hereinafter referred to as the "said Borrowers"), and Mr. Bhimsing Himjibhai Rathva S/o Mr. Himjibhai Rathva (Guarantor) (hereinafter referred to as the "said Guarantor"), to repay the amounts mentioned in the Notice, within 60 days from the date of receipt of Notice, as per details given below.

2. The said Notices have been returned undelivered by the postal authorities/ have not been duly acknowledged by the borrowers /mortgagors /

uarantors Mr. Narsinh Rimabhai Rathva S/o Mr. Rimabhai Rathva (Borrower cum Mortgagor) and Mr. Bhimsing Himjibhai Rathva S/o Mr Ilimjibhai Rathva (Guarantor) Hence the Bank by way of abundant caution is effecting this publication of the demand notice. The undersigned has, therefore, caused these Notices to be pasted on the premises of the last known addresses of the said Borrowers/ mortgagors/ guarantors Mr. Narsinh Rimabhai Rathva S/o Mr. Rimabhai Rathva (Borrower cum Mortgagor) and Mr. Bhimsing Himjibhai Rathva S/o Mr. Himjibha Rathva (Guarantor) as per the said Act. Copies of the said Notices are available with the undersigned and the said Borrowers/ mortgagors guarantors Mr. Narsinh Rimabhai Rathva S/o Mr. Rimabhai Rathva (Borrower cum Mortgagor) and Mr. Bhimsing Himjibhai Rathva S/o Mr. Himjibhai Rathva (Guarantor), may, if they so desire, collect the said copies from the undersigned on any working day during normal office hours. 3. Against the above background, Notice is hereby given, once again, to said Borrowers/ mortgagors/ guarantors Mr. Narsinh Rimabhai Rathva So Mr. Rimabhai Rathva (Borrower cum Mortgagor) and Mr. Bhimsing Himjibhai Rathva So Mr. Himjibhai Rathva (Guarantor) to pay to Indian Overseas Bank, within 60 days from the date of publication of this Notice, the amounts indicated/payable as given /under the loan & other documents. As security for due repayment of the loan, the following assets have been mortgaged to Indian Overseas Bank by the respective

parties as below.						
SI NO		Total Outstanding Rs as on	Description of Secured Assets			
1	Mr. Narsinh Rimabhai Rathva S/o Mr. Rimabhai Rathva (Borrower cum mortgagor) A-401, Affordable Housing Scoiety, MIG Flat, Nr. Ambalal Park, Karelibaug, Vadodara-390018. Also at: Tower E 104, Sakar 99 Complex, Nr. Water Tank, Gotri, Gotri Talav, Vadodara, Gujarat-390021. Mr. Bhimsing Himjibhai Rathva S/o Mr. Himjibhai Rathva (Guarantor of Facility no. 01 mentioned here in) 13, Dwarika Nagar, Nr. Sarswati Vidhyalay, Ajwa Road, Vadodara, Gujarat-390019.	1) Housing Loan Rs. 17,41,174.00 2) Term Loan Rs. 6,43,121.00 3) Cash Credit Rs. 3,22,417.40 4) Term Loan Mudra Rs. 2,71,463.00 Total: Rs. 29,78,175.40 as on 22.05.2023	All that part and parcel of House property situated at Registration Dist. Baroda Sub Dist. Baroda land bearing R.S. No. 946 area adm. 5312 sq.mtr TPS 60 FP-102 in constructed the scheme in the name & Style of Sakar-99 bearing Tower-E, 1st Floor Flat No. 104 built up area adm 42.00 Sq.Mtr., undivided common land - plot-road area adm 33.00 sq.mtr, total area adm. 75.00 sq.mtr, mouje-Gotr in the name of Mr. Narsinh Rimabhai Rathva (sale deed Doc No. 8880 dated 16.08.2019) Pin Code-390021. Boundaries: East: Adj Flat No. E-101, West: Adj Society Common Plot, North: Adj F.P. No. 100, South: Adj Tower-D Flat no. E-103.			
Domand Nation Data for 122 05 2022						

Demand Notice Date for : 22.05.2023

Payable with further interest at contractual rates/rests as agreed from the date mentioned above till date of payment. . If the said borrowers/ mortgagors / guarantors Mr. Narsinh Rimabhai Rathva S/o Mr. Rimabhai Rathva (Borrower cum Mortgagor) and Mr. Bhimsing Himjibhai Rathva š/o Mr. Himjibhai Rathva (Guarantor) fail to make payment to Indian Overseas Bank as aforesaid, then Indian Overseas Bank shall proceed against the above secured assets under Section 13(4) of the SARFAESI Act and Rules entirely at the risks, costs and onsequences of the said borrowers/ mortgagors/ guarantors.

5. Further, the attention of borrowers/mortoagors / guarantors Mr. Narsinh Rimabhai Rathya S/o Mr. Rimabhai Rathya (Borrower cum Mortgagor) and Mr. Bhimsing Himjibhai Rathva S/o Mr. Himjibhai Rathva (Guarantor) is invited to provisions of Sub-section(8) of the Section 13 of the Act, in respect of time available to them to redeem the secured assets.

The said Borrowers/ mortgagors / guarantors Mr. Narsinh Rimabhai Rathya S/o Mr. Rimabhai Rathya (Borrower cum Mortgagor) and Mi Bhimsing Himjibhai Rathva Sío Mr. Himjibhai Rathva (Guarantor) are prohibited under the SARFAESI Act from transferring the secured assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of Indian Overseas Bank. Any person who contravenes or abet ontravention of the provisions of the Act or Rules shall be liable for imprisonment and/or fine as given under Section 29 of the Act.

Date: 31.05.2023 - Place: Karelibaug

INTERNATIONAL LTD.

Regd. Office :G.S.Estate, G.T.Road, Ludhiana-141010 Ph. 0161-2511001-05 (5 Lines), Fax: 0161-2510885 CIN No.: L34300PB1973PLC003301 www.gsgroupindia.com, E-mail:-info@gsgroupindia.com

Extract of Audited Financial Results for the Quarter/year ended 31st March, 2023

SI.	Particulars	Quarter Ended			Year Ended	
No.		Audited	Un-Audited	Audited	Audited	
		31/03/2023	31/12/2022	31/03/2022	31/03/2023	31/03/2022
	Total Income from operations (Net)	3802.09	3238.92	3274.44	12969.36	10044.09
2	Net Profit/(Loss) for the period/year (before tax,	(258.79)	(72.70)	132.31	(480.75)	32.60
	exceptional and/or Extraordinary items)					
}	Net Profit/(Loss) for the period/year before tax (after	(258.79)	(72.70)	132.31	(480.75)	32.60
	Exceptional and/or Extraordinary items)					
	Net Profit/(Loss) for the period /year after Tax (after	(125.08)	(52.92)	(57.38)	(279.43)	(312.75
	exceptional and/or Extraordinary items)					
5	Total Comprehensive Income for the period/year	(17.10)		22.51	(17.10)	22.5
	[Comprising Profit/(Loss) for the period /year (after tax)					
	and other Comprehensive Income (after tax)					
3	Equity Share Capital (Face Value Rs.5/- Each,	725.73	725.73	725.73	725.73	725.73
	fully paid up)					
,	Reserves (excluding Revaluation Reserves)				1316.58	1613.1
}	Earning Per Share (for continuing and discontinued					
	operations) (Face Value Rs.5/- each) (Not Annualised)					
	(i) Basic & Diluted EPS before Extraordinary items. (Rs.)	(0.87)	(0.36)	(0.39)	(1.93)	(2.15
	(ii) Basic & Diluted EPS after Extraordinary items. (Rs.)	(0.87)	(0.36)	(0.39)	(1.93)	(2.15

- 1 The above Audited financial results were reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their meeting held on 30th May, 2023 and have been reviewed by the Statutory Auditor.
- As the Company's business activity falls within a single segment viz. "Auto Components" and the sales substantially being in the
- domestic market, hence the same is reflective of the disclosure requirements of Ind AS-108 Operating Segments Previous period's/years figures have been regrouped & reclassified, wherever required.
- 4 The figures of last quarters are the balancing figures between the audited figures in respect of full financial year and the published

year to date figures upto the 3rd guarter of the current financial year. For G.S. Auto International Limited

(Harkirat Singh Ryait)

(Executive Director) DIN No.:07275740

Place : Ludhiana Date: 30.05.2023

OMKAR PHARMACHEM LIMITED

Regd. Off. 310, Wall Street-1, Near Gujarat College Cross Road, Ellisbridge, Ahmedabad-380006. Ph. +91 9711811163 CIN: L93000GJ1995PLC025276 Website: www.omkarpharmachem.co.in Email: investors.opl@gmail.com

Extract of the Standalone Audited Results for the Quarter and Year ended 31st March, 2023

		(Rs. in lak	th except per	share data)
Particulars	Quarter Ended (Audited) 31.03.2023	Year Ended (Audited) 31.03.2023	Quarter Ended (Audited) 31.03.2022	Year Ended (Audited) 31.03.2022
Total income from Operations (Net)	13.50	54.00	13.50	54.00
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	5.83	26.45	2.83	21.05
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	5.83	26.45	2.83	21.05
Net Profit(Loss)for period after tax (after Exceptional items)		19.78	0.09	18.31
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)				
for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(0.84)	19.78	0.09	18.31
Equity Share Capital (Face Value Rs. 10/-each)	1008.37	1008.37	1008.37	1008.37
Other equity	(104.00)	(104.00)	(123.79)	(123.79)
Earning Per Share(before & after extraordinary items)(of Rs. 10 each)				
Basic and diluted Rs.	(0.0083)	0.1962	0.0009	0.1816

Date : 30.05.2023

: Ahmedabac

- 1) The above is an extract of the detailed format of Audited Quarterly and Yearly Ended Financial Results filed with the Stocl Exchanges under Regulation 33 of the SEBI (Listing Other and Disclosure Requirements) Regulations, 2015. The full formation of the Audited Quarterly and Annual Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.omkarpharmachem.co.in
- 2) The above results have been reviewed by the audit committee & approved by the Board of Directors at their respective meetings held on 30th May 2023

3) Exceptional items/Extraordinary items, if any, are adjusted in the statement of profit and loss in accoudance with IND-AS rules.

By order of the Board For, Omkar Pharmachem Limited Sd/-

Bhawani Shankar Goyal **Managing Director** DIN: 03255804

Address: House No. 155/2, First Floor, Gali No. - 2 Nr. Gurudwara, Govindpuri, Kalkaji-110019 (Delhi) RACPC-2 (63692) , 2nd Floor, 213-219, RIO Empire, Opp. R.T.O. Pal, Surat-395 009 E-mail - sbi.63692@sbi.co.in POSSESSION NOTICE (For im

Whereas, The undersigned being the Authorized Officer of the State Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act. 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued demand notice dated 21/03/2023 calling upon the borrower Mrs. Arpitaben Himanshubhai Patel to repay the amount mentioned in the notice being Rs.1,54,71,340/- (Rupees One Crore Fifty Four Lacs Seventy One Thousand Three Hundred Forty Only) with interest, cost, charges, etc, within 60 days from

the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the orrowers/ guarantors and the public in general that the undersigned has taken the Symbolic Possession of the properties described herein bellow in exercise of owers conferred upon me under Section 13 (4) of the said Act read with Rule 8 of ne said rules on this 24/05/2023.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of the State Bank Of India, RACPC-II, 2nd FLOOR, 213- 219, Rio Empire, Opp. R.T.O. Pal, Surat-395 009 for an amount of Rs.1,54,71,340/- mentioned in the notice and further interest thereon etc till the date of payment and / or

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of he Act, in respect of time available, to redeem the secured assets

Description of the Property

Flat No. 403, 4th floor, Palazzo, Opposite Shaligram Signature, Pal Main Road, Pal, Surat.

Date: 24/05/2023 Place : Surat

Chief Manager & Authorized Officer State Bank of India, Surat.

Bhestan Branch, Shop No. 1-3, Sai Square Building, Udhana Navsari Road, Bhestan, Surat-395023. Ph. 0261-2890138 & 2895376. Email:dbhhes@bankofbaroda.co.in POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)



Whereas, The undersigned being the authorized officer under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcemen of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 200 issued a demand notice dated 30/04/2019 calling upon the borrower/Guarantor Mr. Namdev Jivan Mali (Borrower & Mortgagor), Mrs. Rukmaniben Namdev Mali (Co- Borrower) and Shri Yogesh Bhaidas Patil (Guarantor) to repay the amount entioned in the notice Rs.9.88.051.74 (Rupees Nine Lakhs Eighty Eigh Thousand Fifty one and Seventy Four Paise Only) and interest thereon within 6 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the

orrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him unde sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interes Enforcement) Rules, 2002 on this the day of 29th day of May of the year 2023. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, for an amount of Rs.9,88,051.74 plus interest thereo and other charges thereon.

Description of the Immovable Property

All that piece and parcel of Plot No. 172, (As per K.J.P. Record Block No. 85/172, admeasuring 40.23sg.mtrs.) of the society known as "Sai Aangar Residency" situated at Near Sai Deep Residency, Jolva, Palsana bearing Revenue Survey Nos. 100 & 101. Block No. 85 of Village: Jolya, Taluka Palsana, District : Surat total admeasuring about 53.36 square yards i.e 44.62 square meters in the name of Mr. Namdey Jivan Mali and Mrs Rukmaniben Namdev Mali. **Authorised Officer**

Date: 29/05/2023 **Place: Surat**

Bank of Baroda, Surat



Circle SASTRA Centre : 1st Floor Meghani Tower, Station Road, Surat, Gujarat-3 Ph.: 0261-2451873 email: cs8323@pnb.co.in 60 Days' Notice to Borrower/Gauranto

o. M/s Jai Ambe Industries (A Proprietorship Firm) Survey no.375/7.Gala no.2. KRRG mpound, Hill Indl.Estate, Kachigam, Daman-396210 Mr.Pramod KrishanChand Sharma Proprietor of M/s Jai Ambe Industries and Partner in

M/s Maruti Textile Flat No.504/A, Abhilasha Complex, M.G.Road, Khariwad, Vani Daman - 396210 Mr.Subhash Krishana Sharma Guarantor and Partner in M/s Maruti Textiles Gala No.

Survey No.375/7,KRRG Compound,Hill-Industrial Estate, Kachigam,Daman M/s Mahavir Textile Industries Mortgagor of M/s Jai Ambe Industries Building No.D. 1st

loor,Survey No.375/7,Hill Industrial Estate ,Zari causeway,Kachigam, Nani Daman-396210 M/s Maruti Textile (Partnership Firm) Guarantor Building no.D,1st floor, (Part) Survey No. 375/7, Hill Industrial Estate, Zari Causway, Kachigam, Daman-396210

NOTICE U/S 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (SARFAESI) Reg: NPA Account No.7170008700000459 Credit facilities availed by M/s Jay Ambe

You, Mr. Pramod Krishanchand Sharma Proprietor of M/s Jay Ambey Industries havin

registered address at Survey no.375/7, Gala no.2,KRRG Compound,Hill ind. has followin utstanding credit facilities: -

Particulars	Amount
Credit facilities Sanctioned/ Availed Limit with account number	Cash Credit Rs.77,00,000.00
ROI at the time of Sanction as per sanction letter	10.75%
Prevailing Rate of Interest	10.20%
Principal Outstanding (A)	85,07,434.60
Interest as on 30/04/2023 (date of issuance of notice (B)	59,99,940.00
Other Charges (C)	0.00
Recovery After date of NPA (i.e. 12.10.2018) (D)	0.00
Total Outstanding as on 30.04.2023 (date of issuance of notice) (A+B+C+D)	Rs.1,45,07,374.60
Total	Rs.1,45,07,374.60

That you all are the borrowers in view of the definition provided under Section 2(f) of the That the undersign is the authorized office in view of the definition provided under Rule 2(a) o

the Security Interest (enforcement) Rules, 2002. That the registered mortgage was created on 07.07.2016 to secure the facility.

Due to non-payment of instalment/ interest/ principal debt, the account/s has/have been classified as Non-Performing asset on 12.10.2018 as per Reserve bank of India.

We have demanded/recalled the entire outstanding together with interest and other charges due under the above facilities vide our letter dated 23.10.2018. he amount due to the Bank as on 30.04.2023 is Rs. Rs.1,45,07,374.60 (Rs.One Crore Forty Five Lac Seven Thousand Three Hundred Seventy Four and Sixty Only.) With furthe

terest until payment in full (hereinafter referred to as "secured debt"). To secure the outstanding under the above said facilities, you have, inter alia, created security terest in respect of the following properties/assets.

Nature of Facility/ies | Security

(Primary Security)
Hypothecation on entire current assets (Present & Future) of the firm including stocks of raw materials, stocks in process, finished goods, receivables, store, spares, consumables etc. (Collateral Security)

All that piece and parcel of property being the first floor admeasuring about 4605.00 sqr.ft, lying and being on the industrial building No.

D. constructed on N.A. land bearing survey no.375/7 along with proportionate share in the land situated at Vill-Kachigam , Nani Daman, Daman belonging in the name of M/s Mahavir Textile Industries, A Partnership Firm.(Partners-(1.)Mr.Subhash Krishna Sharma, (2.)Mr.Pramod KrishnaChand Sharma) We hereby call upon you to pay the amount of Rs. Rs.1,45,07,374.60 (Rs.One Crore Forty

ive Lac Seven Thousand Three Hundred Seventy Four and Sixty Only.) With further interes at the contracted rate until payment in full within 60 days (Sixty Days) from the date of this notice. In default, besides exercising other rights of the Bank as available under Law, the Bank is intending to exercise any or all of the powers as provided under section 13(4) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act 2002 (hereinafter referred to as "the Act"). The details of the secured asset/s intended to be enforced by the Bank, in the event of non-payment of secured debt by you are as under: Nature of Facility/ies | Security

Cash Credit

(Primary Security)
Hypothecation on entire current assets (Present & Future) of the firm including stocks of raw materials, stocks in process, finished goods, receivables, store, spares, consumables etc.

(Collateral Security)

All that piece and parcel of property being the first floor admeasuring about 4605.00 sqr.ft, lying and being on the industrial building No. D. constructed on N.A. land bearing survey no.375/7 along with proportionate share in the land situated at Vill-Kachigam, Nani Daman, Daman belonging in the name of M/s Mahavir Textile Industries, A Partnership Firm.(Partners-(1.)Mr.Subhash Krishna Sharma, (2.)Mr.Pramod KrishnaChand Sharma)

our attention is hereby drawn invited to provisions of sub-section (8) of section 13 of the Act in respect of time available to you redeem the secured assets

Please take notice that in terms of section 13(13) of the said Act, you shall not, after receipt of this notice, transfer by way of sale, lease or otherwise (other than in the ordinary course o pusiness) any of the secured assets above referred to, without prior written consent of the

You are also put on notice that any contravention of this statutory injunction/restraint, a provided under the said Act. is an offence.

f for any reason, the secured assets are sold or leased out in the ordinary course o business, the sale proceeds or income realized shall be deposited/remitted with/to the Bank

You will have to render proper account of such realization/income *We reserve our rights to enforce other secured assets.

Please comply with this demand under this notice and avoid all unpleasantness. In case of non-compliance, further needful action will be resorted to, holding you liable for all cost

This notice is issued without prejudice to the bank taking legal action before DRT/Court, a *We withdraw our notices u/s 13(2) of SARFAESI Act issued earlier

Date: 18/05/2023 Chief Manager, Authorized Officer, Punjab National Bank